

એકસ્ટ્રા અફેર

ભરત ભારદ્વાજ

feedback@bombaysamachar.com

મોદીવિરોધી રોડ શો, કેનેડા હવે ભારતનું મિત્ર ના બની શકે

કેનેડામાં જસ્ટિન ટ્રુડોના સ્થાને માર્ક કાર્ની વડા પ્રધાન બનતાં સત્તા પરિવર્તન ભલે થયું પણ ભારત વિરોધી ખાલિસ્તાનવાદીઓને રોકવામાં નવી સરકારને પણ કોઈ રસ નથી તેનો પરચો ફરી એક વાર ભારતને મળી ગયો. સોમવારથી કેનેડાના કનાડાસ્કિસમાં વિશ્વના સૌથી ધનિક દેશોના બનેલા યુપ એફ સેવન એટલે કે G-7નું બે દિવસીય સમિટ શરૂ થઈ છે.

ભારત G-7નું સભ્ય નથી પણ વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તાઓમાંથી એક હોવાથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ G-7 સમિટમાં હાજરી આપવા નિમંત્રણ મળ્યું છે. મોદી સોમવારે કેનેડા પહોંચ્યા એ પહેલાં ખાલિસ્તાનવાદી સંગઠનના સમર્થકોએ એક જબરદસ્ત રોડ શો કરીને મોદી વિરોધી દેખાવો કર્યાં અને ભારત વિરોધી ઝેર એકઠું તેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે, કેનેડામાં સરકાર કોઈની પણ હોય, ખાલિસ્તાનવાદીઓને રોકવામાં કોઈને રસ નથી અને કેનેડા ફરી ભારતનું મિત્ર બની શકે તેમ નથી.

કેનેડાના કેલગરી પ્રાંતમાં ગુસ્તારા દશમેશથી શરૂ થયેલા ૨૦૦ કરતાં વધારે કાર-ટ્રક સાથેના રોડ શોમાં ખાલિસ્તાનવાદીઓએ નરેન્દ્ર મોદીની કેનેડાની મુલાકાત અને G-7 સમિટમાં મોદીને નિમંત્રણનો વિરોધ કરીને મોદી અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. મોદીને કેનેડાના દુશ્મન ગણાવીને ખાલિસ્તાનવાદીઓએ ધમકી પણ આપી કે, મોદીને ખતમ કરી દેવાશે. આ રોડ શોના આયોજન ખાલિસ્તાનના સમર્થક મનજિંદર સિંહે કિશિયારી મારી કે, અમે મોદીના રાજકારણને ખતમ કરવા માટે અહીં ભેગા થયા છીએ અને અમે કેનેડાને સુરક્ષિત બનાવવા માગીએ છીએ.

ખાલિસ્તાનવાદીઓએ ભારતીય હિન્દુઓને ગાળાગાળી કરીને એવું કહ્યું કે, મોદી કેનેડામાં રહેશે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. રોડ શો દરમિયાન ખાલિસ્તાન ઝિંકાબાઢના નારા પણ લગાવવામાં આવ્યા અને મોદીનું પૂતળું રસ્તા પર લઈ જઈ હાથકડી પણ પહેરાવવામાં આવી. મોદી સરકાર કેનેડામાં ખાલિસ્તાનની માગણી કરી રહેલા લોકોની હત્યાઓ કરાવી રહી હોવાના આક્ષેપો પણ કરાયા.

ખાલિસ્તાનવાદીઓના આ ઉધામા એ વાતનો પુરાવો છે કે, માર્ક કાર્ની કે નેડાના વડા પ્રધાન બન્યા પછી પણ ખાલિસ્તાનવાદીઓ ફાટીને ધુમાડે ગયેલા જ છે અને કાર્નીની

સરકારને તેમને રોકવામાં કોઈ રસ નથી. જસ્ટિન ટ્રુડોના સમયમાં ભારત-કેનેડા સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને તેનું કારણ ટ્રુડોનું ખાલિસ્તાનવાદીઓ તરફ નરમ વલણ હતું. જાન્યુઆરી ૨૦૨૫માં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ૧૪ માર્ચે માર્ક કાર્ની કેનેડાના નવા વડા પ્રધાન બન્યા અને પછી ચૂંટણી યોજીને તેમણે ફરી સત્તા હાંસલ કરી છે.

કાર્નીએ વડા પ્રધાનપદે બેઠા પછી ભારત સાથેના સંબંધો સુધારવાની મોટી મોટી વાતો કરેલી પણ મોદી વિરોધી રોડ શો એ વાતનો પુરાવો છે કે, કાર્ની ખાલી વાતો કરે છે, બાકી તેમને ભારત સાથેના સંબંધો સુધારવામાં કોઈ રસ નથી. રસ હોય તો આ રીતે પોતાની ધરતીનો ઉપયોગ ભારતના વડા પ્રધાન સામે ઝેર ઓકવા માટે કરવા દે ખરા ?

G-7 દુનિયાના સૌથી ધનિક દેશોનું બનેલું સંગઠન છે તેથી આ સંગઠનના સમિટમાં શું બને છે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી હોય છે. એ જ વખતે ખાલિસ્તાનવાદીઓ મોદીવિરોધી રોડ શો કરે તેથી રોડ શોને આખી દુનિયામાં પન્લિસિટી મળે એ કહેવાની જરૂર નથી. આ વાત કાર્ની સરકારમાં બેઠેલા લોકોને ના સમજાય એટલા નાદાન એ નથી જ ને છતાં કાર્ની સરકાર તેમને રોકે નહીં તેનો સીધો મતલબ એ થયો કે, ખાલિસ્તાનવાદીઓને કેનેડા સરકારનું પીઠભગ છે અને તેમની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરાય છે.

કેનેડાની સરકાર ખાલિસ્તાનવાદીઓને કેમ છાવરે છે એ ઓપન સિક્રેટ છે. કેનેડાની સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ કોમન્સની ૨૦૨૫ની ચૂંટણીમાં શીખ મતદારોએ કાર્નીની લિબરલ પાર્ટીને ખોબેખોબે મત આપ્યા છે. કેનેડાની ૩.૭૦ કરોડની વસતીમાં ૧૬ લાખ એટલે કે લગભગ ચાર ટકા ભારતીય મૂળનાં લોકો છે અને તેમાંથી અડધા એટલે કે ૭.૭૦ લાખ શીખ છે.

કેનેડાના ૩૪૩ સાંસદોમાંથી ૨૨ શીખ છે અને તેમાંથી ૧૨ લિબરલ પાર્ટીના છે. અત્યાર લગી બહુમતી શીખ મતો જગમતસિંહની ન્યુ એમેકેટિક પાર્ટીને મળતા હતા પણ ટૂંકોએ ખાલિસ્તાનવાદીઓની ભક્તિ કરી તેમાં શીખ મતદારો લિબરલ પાર્ટી તરફ વળ્યા. તેના કારણે ન્યુ એમેકેટિક પાર્ટી ધોવાઈ ગઈ ને ફાયદો કાર્નીની લિબરલ પાર્ટીને થયો. ટૂંોના સમયમાં

ઈરાનની હવાઈ સીમા પર નિયંત્રણ મેળવ્યું હોવાનો ઈઝરાયલનો દાવો

તેલ અવીવઃ ઈરાનની હવાઈ સીમા પર નિયંત્રણ મેળવ્યું હોવાનો ઈઝરાયલે સોમવારે દાવો કર્યો હતો. ઈઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે અમે ઈરાનની ઍર ડિફેન્સ સિસ્ટમને એટલી નબળી પાડી દીધી છે કે હવે કોઈ પણ પ્રકારના મોટા અવરોધ વિના અમારા વિમાનો ઈરાનની હવાઈ સીમામાં અવરજવર કરી શકે છે.

પશ્ચિમ ઈરાનથી તહેરાન સુધીની હવાઈ સીમા પર અમે નિયંત્રણ મેળવી

ગાઝા પર ઈઝરાયલી હુમલામાં ૧૬નાં મોત

દેઈર અલ-બલાહ (ગાઝા પટ્ટી): સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગાઝા પટ્ટી પર રાતોરાત અને શનિવારે ઈઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા ૧૬ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. હમાસ સાથે ૨૦ મહિનાથી ચાલતું યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલી અને યુએસ સમર્થિત માનવતાવાદી જૂથ દ્વારા સંચાલિત ખાધ વિતરણ સેન્ટરો નજીક રાત્રે વધુ ૧૧ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

પેલેસ્ટિનિયન સાક્ષીઓનું કહેવું છે કે ઇઝરાયલી દળોએ ભીડ પર ગોળીબાર કર્યો છે, જ્યારે સૈન્યનું કહેવું છે કે તેણે ફક્ત એવા લોકોની નજીક ચેતવણીના ગોળીબાર કર્યા છે જેમને તે શંકાસ્પદ તરીકે વર્ણવે છે જેઓ તેનાં દળો પાસે પહોંચ્યા હતા.

નવીમત્તમ ગોળીબાર અંગે ટિપ્પણી માટેની વિનંતીઓ સૈન્યએ તાત્કાલિક જવાબ આપ્યો ન હતો. આ સ્થળો લશ્કરી વિસ્તારોમાં સ્થિત છે જે સ્વતંત્ર પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

ગાઝા હુમેનિટેરિયન ફાઉન્ડેશને

કે ઇઝરાયલી દળોએ ભીડ પર ગોળીબાર કર્યો છે, જ્યારે સૈન્યનું કહેવું

છે કે તેણે ફક્ત એવા લોકોની નજીક ચેતવણીના ગોળીબાર કર્યા છે જેમને તે શંકાસ્પદ તરીકે વર્ણવે છે જેઓ તેનાં દળો પાસે પહોંચ્યા હતા.

નવીમત્તમ ગોળીબાર અંગે ટિપ્પણી માટેની વિનંતીઓ સૈન્યએ તાત્કાલિક જવાબ આપ્યો ન હતો. આ સ્થળો લશ્કરી વિસ્તારોમાં સ્થિત છે જે સ્વતંત્ર પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

ગાઝા હુમેનિટેરિયન ફાઉન્ડેશને

કે ઇઝરાયલી દળોએ ભીડ પર ગોળીબાર કર્યો છે, જ્યારે સૈન્યનું કહેવું

છે કે તેણે ફક્ત એવા લોકોની નજીક ચેતવણીના ગોળીબાર કર્યા છે જેમને તે શંકાસ્પદ તરીકે વર્ણવે છે જેઓ તેનાં દળો પાસે પહોંચ્યા હતા.

નવીમત્તમ ગોળીબાર અંગે ટિપ્પણી માટેની વિનંતીઓ સૈન્યએ તાત્કાલિક જવાબ આપ્યો ન હતો. આ સ્થળો લશ્કરી વિસ્તારોમાં સ્થિત છે જે સ્વતંત્ર પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

ગાઝા હુમેનિટેરિયન ફાઉન્ડેશને

કે ઇઝરાયલી દળોએ ભીડ પર ગોળીબાર કર્યો છે, જ્યારે સૈન્યનું કહેવું

છે કે તેણે ફક્ત એવા લોકોની નજીક ચેતવણીના ગોળીબાર કર્યા છે જેમને તે શંકાસ્પદ તરીકે વર્ણવે છે જેઓ તેનાં દળો પાસે પહોંચ્યા હતા.

આજનું પંચાંગ

પંડિત જિતેન્દ્ર હરિહર મહેસાણાવાળા

ઉત્તરાયણ – સૌર ગ્રીષ્મઋતુ, મંગળવાર, તા. ૧૭-૬-૨૦૨૫, પંચક, ભદ્રા

- ભારતીય દિનાંક ૨૭, માંહે જયેષ્ઠ, શકે ૧૯૪૭
- વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૭, જયેષ્ઠ વદ-૬
- જૈન વીર સંવત ૨૫૫૧, માંહે જયેષ્ઠ, તિથિ વદ-૬
- પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માંહે ૧૧મો બેહમન, સને ૧૩૯૪
- પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માંહે ૧૨મો સ્પેન્દામંદ, સને ૧૩૯૪
- પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માંહે ૪થો તીર, સને ૧૩૯૪
- મુસ્લિમ રોજ ૨૦મો,માંહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૬
- મીસરી રોજ ૨૧મો, માંહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૬
- નક્ષત્ર શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૧ સુદી (તા. ૧૮) પછી પૂર્વાભાદ્રપદા.
- ચંદ્ર કુંભમાં
- ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ધ)
- સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૫, રટા.ટા.,
- સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૫, રટા. ટા.

મુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઢ્ર

ભરતી: સાંજે ક. ૧૬-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૬ (તા. ૧૮)
ઓટ: સવારે ક. ૦૯-૨૫, રાત્રે ક. ૨૨-૪૦
પ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, ‘અનલ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૭ ‘વિશ્વાવસુ’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ-ષષ્ઠી. પંચક, ભદ્રા બપોરે ક. ૧૪-૪૭થી ૨૬-૧૫. સૂર્ય મહાનક્ષત્ર મૃગશીર્ષમાં, પાહળ શિયાળ
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્ણ છે.
મુહૂર્ત વિશેષ: મેંગળ-રાહુ ગ્રહદેવતાનું પૂજન, વરુણદેવતાનું પૂજન, કર્દબનું વૃક્ષ વાવવું, સર્વશાંતિ પૂજા, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ઘજા-કળશ પતાકા ચઢાવવું, બગીચો બનાવવો, માલ લેવો, નિત્ય થતાં દુકાન-નોકરી અંગેના કામકાજ, દાન્ય વેંચવું, વૃક્ષ વાવવા, નિત્ય થતાં પશુ લેવડદેવડના કામકાજ.
આચમન: ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્રબુદ્ધિ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ (તા. ૧૮), મંગળ મધા યુતિ ગ્રહયોગર: સૂર્ય- મિથુન, મેંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરુ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, માર્ગી હર્ષલ-વૃષભ, માર્ગી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

બિહારમાં અકસ્માતમાં પાંચનાં મોત, ૧૮ ઘાયલ

સારણ: બિહારના સારણ મુસાફરોને લઇ જતી એક પિકઅપ જિલ્લામાં સોમવારે ટાયર ફાટવાથી એક પિકઅપ વાન પલટી જતાં ભયંકર અકસ્માત સર્જયો હતો. જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ૧૮ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી પોલીસે આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત જિલ્લાના નયાગાંવ વિસ્તાર નજીક થયો હતો. પોલીસ મુત્કો કરી ઘાયલોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. સારણના વરિષ્ઠ પોલીસ અધિક્ષક(એસએસપી) કુમાર આશિષે જણાવ્યું કે આ ઘટના સોમવારે સવારે ૬ વાગ્યાની આસપાસ નયાગાંવ વિસ્તાર નજીક બની હતી. કેટલાક

ઉત્તર પ્રદેશમાં સરયૂ નદીમાં ત્રણનાં ડૂબી જવાથી મોત

દેવરિયા: ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં સોમવારે સરયૂ નદીમાં નહાતી વખતે બે ભાઇઓ સહિત ત્રણ લોકોનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. આ જાણકારી અધિકારીઓએ આપી હતી. બરહુજ ના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ(એસડીએમ) વિપિન દિવેદીના જણાવ્યા અનુસાર પીડિત પ્રદીપ(૨૪), મૃતદેહો અને ઓછામાં ઓછા ૧૨૫ ઘાયલ લોકો મળ્યા છે.

૨૦૨૭માં વસ્તી ગણતરી માટે જાહેરનામું જાહેર કરાયું

નવી દિલ્હી : સરકારે સોમવારે ૨૦૨૭માં ૧૬મી જાતિ ગણતરી સાથે ભારતની વસ્તી ગણતરી હાથ ધરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે ૧૬ વર્ષ પહેલાં ૨૦૧૧માં છેલ્લી વખત કરવામાં આવી હતી.

લદાખ જેવા બરફથી ઘેરાયેલા વિસ્તારોમાં ૧ ઓક્ટોબર, ૨૦૨૬ અને દેશના બાકીના ભાગોમાં ૧ માર્ચ, ૨૦૨૭ ની સંદર્ભ તારીખ સાથે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે, એમ જાહેરનામામાં જણાવાયું છે.

ઉક્ત વસ્તી ગણતરી માટે સંદર્ભ તારીખ ૧ માર્ચ, ૨૦૨૭ના રોજ ૦૦.૦૦ કલાક રહેશે, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ અને જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફથી ઘેરાયેલા બિન-સમકાલીન વિસ્તારો સિવાયનો સમાવેશ થાય છે, એમ તેમાં જણાવાયું છે. લદાખ અને જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફથી ઘેરાયેલા બિન-સમકાલીન વિસ્તારોના સંદર્ભમાં, સંદર્ભ તારીખ ૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ૦૦:૦૦ કલાક રહેશે, એમ તેમાં જણાવાયું છે.

દેશભરમાંથી વસ્તી સંબંધિત ડેટા આપવાની આ વિશાળ કવાચ લગભગ ૩૪ લાખ ગણતરીકારો અને સુપરવાઇઝર અને ડિજિટલ ઉપકરણોથી સજ્જ લગભગ ૧.૩ લાખ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે.

એક સરકારી નિવેદનમાં જણાવાયું છે કે વસ્તી ગણતરીમાં જાતિ ગણતરી પણ કરવામાં આવશે. લોકોને સ્વ-ગણતરીની જોગવાઈ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે અહીં કેન્દ્રીય ગૃહ સચિવ, રજિસ્ટ્રાર જનરલ અને ભારતના વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંંજય કુમાર નારાયણ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વસ્તી ગણતરીની તૈયારીની સમીક્ષા કરી હતી.

વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં – ઘરવાદી કામગીરી (એચએલઓ) – દરેક ઘરની રહેઠાણની સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓની એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ, બીજા તબક્કામાં માહિતી – વસ્તી ગણતરી (પીહ) – દરેક ઘરના દરેક વ્યક્તિની વસ્તી વિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય વિગતો એકત્રિત કરવામાં આવશે. આ વસ્તી ગણતરી કવાયત શરૂ થયા પછીની ૧૬મી અને સ્વતંત્રતા પછી આઠમી વસ્તી ગણતરી છે, એમ એક સરકારી નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સંગ્રહ, ટ્રાન્સમિશન અને સંગ્રહ સમયે ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ કડક ડેટા સુરક્ષા પગલાં રાખવામાં આવશે.



તન-મન-ધનથી રહો તરૈતાજ

વિદેશી હૂંડિયામણ પણ તકલીફ ઊભી કરી શકે



ગૌરવ મશરૂવાળા

feedback @ bombaysamachar.com

‘બીજા બધા લોકો બહાવરા બનીને શેર વેચી રહ્યા હોય ત્યારે પોતે ખરીદવા અને બીજા બધા લોકો શેર ખરીદવા માટે પડાપડી કહી રહ્યા હોય ત્યારે પોતે વેચવા, એવું રોકાણમાં બીજા બધા કરતાં અલગ વલણ અપનાવવામાં ઘણી ધીરજ, શિસ્ત અને હિંમતની જરૂર હોય છે.’

– સર જોન ટેમ્પલ્ટન

રમેશ મહેતાએ આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કર્યું

રોકાણના સમયગાળામાં અમેરિકન ઈક્વિટી માર્કેટમાં તેજ જરૂર આવી હતી, પરંતુ એ અરસામાં ભારતીય રૂપિયો ડૉલરની તુલનાએ ઘણો મજબૂત થઈ ગયો હતો અને એક ડૉલરનો ભાવ ૫૮ રૂપિયા ચાલી રહ્યો હતો. એમના રોકાણનું મૂલ્ય ચોક્કસપણે વધ્યું હતું, પરંતુ ડૉલરનું રૂપિયામાં રૂપાંતર કરવામાં આવ્યું ત્યારે મૂલ્ય ઘટી ગયું!

હવે મારા અન્ય કલાયન્ટ-શ્રીમતી બેનજીનો કિસ્સો જુઓ. એ ભારત પાછા ફરતાં પહેલાં ૨૫ વર્ષ સુધી અમેરિકામાં રહ્યાં હતાં. એ ૨૫ વર્ષમાં એમણે નિવૃત્તિ માટેનું મોટું ભંડોળ જમા કર્યું હતું. અમેરિકામાં નિવૃત્તિ માટેનું ભંડોળ એકદું કરવાની યોજના ‘૪૦૧K’ નામે ઓળખાય આવે છે. એમની કુલ જમા રકમ ૭૫,૦૦૦ ડૉલર હતી. એ ભારત પાછા ફર્યા એ વખતે એક ડૉલરનું મૂલ્ય ૬૦ રૂપિયા હતું. એમણે અઢી વર્ષે ‘૪૦૧K’ની જમા રકમનો ઉપાડ કર્યો. ત્યાર સુધીમાં રૂપિયાનું મૂલ્ય ઘટીને એક ડૉલર દીઠ ૬૫ રૂપિયા થઈ ગયું હતું. શ્રીમતી બેનજીએ અઢી વર્ષ પહેલાં જ નાણાંનો ઉપાડ કર્યો હોત તો એમને ઓછી રકમ મળી હોત.

હવે મારી વાત. થોડાં વર્ષો પહેલાં હું એક કોન્ફરન્સ માટે બ્રિટન ગયો હતો. જતી વખતે મેં એક પાઉન્ડના ૭૬ રૂપિયાના હિસાબે પાઉન્ડની ખરીદી કરી હતી. પાછા ફર્યા બાદ હું વેધલા પાઉન્ડ વટાવવા ગયો. ત્યાર સુધીમાં પાઉન્ડનું મૂલ્ય વધ્યું હતું અને એક પાઉન્ડના ૭૬.૭૫ રૂપિયા મળતા હતા. તેને લીધે મેં જતી વખતે ચૂકવેલી રકમ કરતાં વધારે રકમ મને મળી !

ટૂંકમાં, આપણે દેશની બહાર રોકાણ કરીએ ત્યારે વિદેશી હૂંડિયામણને સંબંધિત જોખમ (ફોરેન એક્સચેન્જ રિસ્ક) લાગુ પડે છે. વિદેશી ચલણના વિનિમય દરમાં થતા ફેરફારને લીધે આવું થાય છે.

આથી ઘણી વાર હું મારા બિનરહીશ ભારતીય (એનઆરઆઇ) રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ નહીં કરવાની સલાહ આપું છું. ભારતીય માર્કેટમાં સારું વળતર છૂટ્યું હોય છે, પરંતુ વિનિમય દરના



રોકાણનાં જોખમ

ફેરફારને લીધે એનઆરઆઇ રોકાણકારોને એટલો લાભ થયો નહીં હોવાના અનેક કિસ્સાઓ બન્યા હોવાથી હું આવી સલાહ આપું છું.

એનઆરઆઇને હંમેશાં ભારતીય બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટનું આકર્ષણ રહેતું હોય છે, કારણ કે અન્ય દેશોની તુલનાએ ભારતમાં વ્યાજદર વધારે હોય છે. આમ છતાં એમનાં ચલણ અને ભારતીય રૂપિયાના વિનિમય દરને ધ્યાનમાં લેતાં ક્યારેક વળતર ધાર્યા જેટલું ન મળે એ સ્વાભાવિક છે. આમ, ફોરેન એક્સચેન્જ રિસ્ક લાગુ પડે છે. આ જોખમની સામે રક્ષણ મેળવવા માટેના અનેક વિકલ્પો છે, પરંતુ એ આપણી ચર્ચાનો વિષય નથી.

ઉપરોક્ત ચર્ચા પરથી એવું ન માની લેતા કે હું પોતાના દેશની બહાર રોકાણ નહીં કરવાની ના પાડું છું. ખરું પૂછો તો આપણે અગાઉ કહ્યું હતું કે ડાઇવર્સિફિકેશનની દૃષ્ટિએ અન્ય દેશમાં રોકાણ કરવું જરૂરી પણ હોય છે. શક્ય હોય ત્યાં વિદેશમાં પણ રોકાણ કરવું, પરંતુ ત્યાં રોકાણ કરતી વખતે ફોરેન એક્સચેન્જ રિસ્કને ધ્યાનમાં લીધા બાદ જ આગળ વધવું. ■

શું તમારા આરોગ્ય વીમામાં OPD કવર સામેલ છે?



વીમા



સુરક્ષાકવચ

નિશા સંઘવી

feedback @ bombaysamachar.com

હોસ્પિટલના OPD (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ)માં મળતી સારવારનો ખર્ચ આરોગ્ય વીમા કંપની ચૂકવે એવા પ્લાનને ‘ઓપીડી કવર’ કહેવામાં આવે છે. આ સારવારમાં ડોક્ટરનું કન્સલ્ટેશન, નિદાન માટેનાં પરીક્ષણો, ડોક્ટરે લખી આપેલી દવાઓ, નાની ટ્રીટમેન્ટ અને પ્રોસીજર, દાંતની ટ્રીટમેન્ટ, વગેરેનો સમાવેશ થાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો, રાખતા મુજબના આરોગ્ય વીમાની જેમ હોસ્પિટલમાં ૨૪ કલાક રહ્યા વગર ઓપીડી ધોરણે લીધેલી સારવારનો ખર્ચ ઓપીડી કવર હેઠળ કલેમ કરી શકાય છે. મોટાભાગની કંપનીઓના આરોગ્ય વીમામાં ઓપીડી કવર વૈકલ્પિક લાભ તરીકે મળે છે, જ્યારે અમુક કંપનીઓની પોલિસીમાં એ પહેલેથી જ સામેલ હોય છે.

પૈસાની બચતની દૃષ્ટિએ ઓપીડી કવર કેવી રીતે ઉપયોગી થાય છે ?

૧) ડોક્ટરની ફીનો ખર્ચ ખીસામાંથી કરવો પડતો નથી: સામાન્ય આરોગ્ય વીમામાં ઓપીડી સારવાર આવરી લેવાયેલી ન હોય ત્યારે એનો ખર્ચ દરદીએ પોતાના ખીસામાંથી કરવો પડે છે. આરોગ્ય વીમો લીધા પછી પણ જો એમાં ઓપીડી કવર ન હોય તો ડોક્ટરની ફીનો ખર્ચ દરદીએ ચૂકવવો પડે છે. ભારતનાં મહાનગરોમાં આ ખર્ચ ઘણો વધી ગયો છે. ઘણી બીમારીમાં નિષ્ણાત ડોક્ટરના કન્સલ્ટેશનની ફીજ ૧,૫૦૦થી ૨,૦૦૦ રૂપિયા જેટલી હોય છે. ઓપીડી કવર લીધું હોય તો આવી ફીનો ખર્ચ બચી જાય છે.

૨) રોગનિદાન પરીક્ષણોનો ખર્ચ ભોગવવો પડતો નથી: તંદુરસ્તી ટકાવી રાખવા માટે નિયમિતપણે, ખાસ કરીને અમુક ઉંમર પછી રોગનિદાન માટે, આરોગ્ય પરીક્ષણો કરાવવાનું સલાહભર્યું હોય છે. વર્તમાન સમયમાં સાધારણ કમ્પ્લટ બ્લડ કાઉન્ટ પરીક્ષણનો ખર્ચ પણ વધતો જાય છે. વળી, એક્સ-રે, એમઆરઆઈ, સીટી સ્કેન, સોનોગ્રાફી, વગેરે જેવાં પરીક્ષણો પણ ઘણાં ખર્ચાળ હોય છે. ઉદાહરણ તરીકે , મુંબઈ જેવા મહાનગરમાં રોગનિદાન પરીક્ષણોનો ખર્ચ ૮,૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા હોય છે.

૩) દવાઓનો ખર્ચ પણ ઓપીડી કવરમાં આવરી લેવામાં આવ્યો હોય છે: અમુક દવાઓ એટલી મોંઘી હોતી નથી, પરંતુ લાંબો સમય ચાલતી અનેક બીમારીઓની દવા નિયમિતપણે લેવી પડતી હોય છે અને એનો ખર્ચ પણ વધારે થઈ જાય છે. ડોક્ટરને બતાવ્યા પછી કોઈ રોગનું નિદાન થાય તો તરત જ દવાઓ લેવાનું પણ શરૂ કરવું પડે છે. ઘણા પરિવારોમાં એક જ વ્યક્તિનો એક મહિનાની દવાનો ખર્ચ ઓછામાં ઓછો ૧,૫૦૦થી ૨,૦૦૦ રૂપિયા જેટલો પણ હોય છે. આરોગ્ય વીમો લીધા પછી પણ ખીસામાંથી ખર્ચ કરવો પડે

તો એ વધારે પડતું કહેવાય. આવમાં ઓપીડી કવર ઉપયોગી થાય છે.

૪) રોગનિદાન વેળાસર થઈ જવાનો લાભ: ‘પ્રિવેન્શન ઇઝ બેટર થેન ક્યોર’ એવું સાચું જ કહેવાયું છે. નિદાન સમયસર થઈ જાય ત્યારે પહેલો લાભ તો એ છે કે રોગ વકરતો અટકી જાય છે. ઘણી બીમારીમાં વેળાસરના નિદાનથી સારવાર વધુ અસરકારક નીવડે છે. જલદી નિદાન થઈ જવાથી દરદી પૂર્ણપણે સાજો થઈ જવાની શક્યતા વધી જાય છે.

૫) કરવેરાનો લાભ: આરોગ્ય વીમા પોલિસી માટે આવક વેરા ધારાની કલમ ૮૦ડી હેઠળ કરકપાત મળે છે. આ જ રીતે ઓપીડી કવર પણ એનો ભાગ હોય તો સ્વાભાવિક છે કે એના માટે પણ કરકપાત મળે. આમ, પોલિસીધારકને ઓપીડીના ખર્ચની બચતની સાથે સાથે કરવેરાની બચતનો પણ લાભ મળે છે.

ઓપીડી કવર સાથેનો આરોગ્ય વીમો કોણે લેવો જોઈએ? ખરું પૂછો તો, ઓપીડી કવર સાથેનો આરોગ્ય વીમો બધાએ ખરીદવો જોઈએ. આમ છતાં, અહીં જણાવ્યા મુજબની વ્યક્તિઓએ તો એ શક્ય તેટલો વહેલો લઈ લેવો જોઈએ.

- * મેદસ્વિતા, ડાયાબીટીસ, હાઇપરટેન્શન, વગેરે જેવી બીમારીઓની ફેમિલી હિસ્ટરી ધરાવતા લોકો
- * વરિષ્ઠ નાગરિકો
- * પોલિસી લેતાં પહેલાં જ અમુક બીમારીઓ ધરાવતા લોકો
- * નાનાં બાળકો ધરાવતા પરિવારો
- * જેમને આરોગ્યસેવાની વધારે વખત જરૂર પડતી હોય
- * જેમની રોગપ્રતિકારકશક્તિ નબળી હોય

ઓપીડી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લેતી વખતે ધ્યાનમાં રાખો... ૧) ઓપીડી કવરજેની ચોગ્ય રકમ નક્કી કરો...

ઓપીડી કવરેજ સાથેના આરોગ્ય વીમાનો પ્લાન નક્કી કરતાં પહેલાં તમારા પરિવારનો દર વર્ષનો સરેરાશ ઓપીડી ખર્ચ કેટલો થાય છે એની નોંધ કરી લેવી. આ રીતે ઓપીડી કવરેજની ચોગ્ય રકમ નિશ્ચિત કરવાનું સહેલું થશે અને વિનાકારણ વીમાનો વધુ ખર્ચ થતો બચી જશે.

૨) સબ-લિમિટ કલોઝ તપાસી લો: અમુક ઓપીડી પ્લાનમાં નિદાન માટેનાં પરીક્ષણો, ડોક્ટરની ફી, વગેરે જેવી ઓપીડી સેવાઓ માટેના ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરનારી સબ-લિમિટ હોય છે. આથી, પ્લાન તમારા ઓપીડીના અંદાજિત ખર્ચને અનુરૂપ છે કે કેમ એ તપાસી લેવું.

૩) નેટવર્ક હોસ્પિટલની યાદી તપાસી લો: મોટાભાગની વીમા કંપનીઓ પોતાની નેટવર્ક ક્લિનિક અને હોસ્પિટલોમાં ઓપીડી સારવાર તથા અન્ય સેવાઓની કેશલેસ સુવિધા ઓફર કરતી હોય છે. તમને માફક આવતી હોય એવી હોસ્પિટલો અને ડોક્ટરો જેની યાદીમાં હોય એવી વીમા કંપની પાસેથી ઓપીડી પ્લાન લેવાનું પસંદ કરવું.

૪) વેઇટિંગ પિરિયડ જાણી લો: કેટલીક પોલિસીમાં ઓપીડીનો કલેમ કરતાં પહેલાં અમુક વેઇટિંગ પિરિયડ પૂરો કરવાનો હોય છે. આથી જેમાં વેઇટિંગ પિરિયડ ઓછો હોય અથવા ન હોય એવી જ પોલિસી લેવાનું વિચારવું, જેથી વખત આવ્યે પોતાના ખીસામાંથી ખર્ચ કરવો ન પડે.

૫) લાભ અને ખર્ચનું સંતુલન રાખો: અનેક કંપનીઓના ઓપીડી પ્લાનની તુલના કરો અને જેમાં ઓછા ખર્ચે મહત્તમ લાભ મળતો હોય એવી જ પોલિસી પસંદ કરો. જરૂરત કરતાં વધુ કવરનો ઓપીડી પ્લાન લેવાનું પણ ટાળવું, કારણ કે એમાં વધુ પ્રીમિયમનો નકામો ખર્ચ થઈ શકે છે. આમ, ઓપીડી પ્લાન અગત્યનો હોવા છતાં પોતાના પરિવારની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ખપપૂરતું કવરેજ ધરાવતો પ્લાન નક્કી કરવો. ■

આ યોગાસનો પાચન સંબંધિત સમસ્યામાં લાભદાયી છે



feedback @ bombaysamachar.com

આરોગ્ય એક્સપ્રેસ

રાજેશ યાજ્ઞિક

બદલાયેલી લાઇફસ્ટાઇલ, વધતા આધુનિકીકરણ અને કાર્યસ્થળ પર બેઠાડું જીવન શૈલીના કારણે અનેક રોગ ઘર કરી જાય છે. તેમાંનો એક દૈનિક જીવનમાં સત્તાવતો રોગ એટલે પાચનની સમસ્યા. પહેલા મોટી ઉંમરે સત્તાવતી સમસ્યા હવે બાળકોથી લઈને કોઈ પણ ઉંમરમાં જોવા મળે છે. તેના માટે ફાકીથી લઈને દવાઓ સુધી ઉપચાર તો લોકો કરે છે, પણ જો તેની સાથે અમુક પ્રકારના યોગ આસનનો પણ અજમાવવામાં આવે તો લાંબે ગાળે ઘણો ફાયદો થાય છે.

ચાલો, જાણીએ એવાં કેટલાંક સરળ આસન, જે પાચન સંબંધી તકલીફોમાં રાહત આપી શકે,જેમકે



પવન મુક્તાસન

નમ: સૂચવે છે તેમ પેટમાં થયેલો ગેસનો ભરાવો મુક્ત કરવા આ આસન ઉપયોગી છે. આ આસન પેટ, નિર્તંબ, જાંઘ અને કુલ્હાને આરામ આપે છે. આંતરડાને આરામ આપવાથી, તમને ગેસ દૂર કરવામાં મદદ મળી શકે છે અને બાથરૂમ જવાનું સરળ બને છે. આ આસન કરવાથી પેટનું ફૂલવું અને ફસાયેલા ગેસને સંકોચન અને મુક્તિ દ્વારા દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.

તમારી પીઠ પર સૂઈ જાઓ પછી તમારા ઘૂંટણને વાળો અને તમારા પગને ૯૦ ડિગ્રી પર લાવો. હાથને તમારી પિંડીની આસપાસ એવી રીતે વીંટાળી દો, જેથી પગનું દબાણ પેટ પર આવે. શ્વાસ ચાલુ રાખો અને તમારા પેટને વિસ્તૃત કરો.

શ્વાસ બહાર કાઢો, જેથી પેટ અંદર જાય અને ફરી તમારા પગ પેટ તરફ દબાવ. ૩ થી ૪ મિનિટ આ રીતે કરતા રહો અને પછી હાથની સાંકળી છોડીને પગને ફરી સીધા જમીન પર ધીમે ધીમે મૂકી દો.



ઊભા રહેવાની સ્થિતિમાં તમારા પગ એવી રીતે રાખો, જેથી બે પગ વચ્ચે થોડું અંતર રહે; બંને હાથને શરીરની સીધમાં ઉપર લઇ જાઓ. એક ઊંડો શ્વાસ લઈને, શ્વાસ છોડતા છોડતા કમરથી શરીરને આગળની તરફ વાળો તમારા હાથના પંજા જમીનને સ્પર્શ કરાવવાની કોશિશ કરો.

સામાન્ય રીતે હાથ પગના સમાંતરે રહે તે મુજબ આસન થાય છે. તમારી ક્ષમતા હોય તેટલું જ વળવું. જો હાથ જમીનને ન સ્પર્શે તો પગ સુધી કે પિંડી સુધી જ્યાં પહોંચે ત્યાં સ્પર્શ કરો.

આ આસન કરતી વખતે તમારા પેટ તરફ ધ્યાન આપો અને શ્વાસોચ્છવાસ ચાલુ રાખો. ૨ થી ૩ મિનિટ આસનની સ્થિતિમાં રહો. પછી ધીમે ધીમે શ્વાસ લેતા લેતા ફરીથી હાથને ઉપર તરફ લઇ જતા શરીરને પણ ઉપર લઇ આવો.



આ આસન પાદ હસ્તાસન જેવું જ છે, પણ તે બેઠેલી સ્થિતિમાં કરવાનું છે. આ આસન પેટનું ફૂલવું ઘટાડવામાં અને પાચન સુધારવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, તે શરીરની

ચેતાને શાંત કરવામાં અને માનસિક ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે.

આસન કરવા પગને આગળ તરફ લાંબા કરીને બેસો. પછી બંને હાથને શ્વાસ લેતા લેતા શરીરની સીધમાં માથા તરફ ઉપર લઇ જાઓ. હવે હાથોને સીધા રાખીને કમરથી શરીરને પગ તરફ વાળો અને બંને હાથોથી પગના તળિયા પકડવાની કોશિશ કરો.

હાથ જેટલા આગળ લઇ શકો તેટલા જ કરવા. તળિયા સુધી ન પહોંચે તો પગના ઉપરના ભાગને પકડવા કોશિશ કરો.

માથું પગ ઉપર ટેકવી દેવું. જો એટલું ન ચૂકી શકાય તો જેટલું નીચે જઈ શકાય તેટલું જવું જેથી પેટ ઉપર દબાણનો અનુભવ થાય.

આસન દરમિયાન શ્વાસોચ્છવાસ ચાલુ રાખવા. ૨ થી ૩ મિનિટ આસનની સ્થિતિમાં રહો. પછી ધીમે ધીમે શ્વાસ લેતા લેતા ફરીથી હાથને ઉપર તરફ લઇ જતા શરીરને પણ ઉપર લઇ આવો.

વજાસન

આ આસન બહુ સરળ છે. વજાસન પાચનમાં સુધારો કરવામાં અને પેટમાં ગેસ ઘટાડવામાં મદદ કરી શકે છે. તે તમારા પેટના સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

તમારા ઘૂંટણને વાળીને ઘૂંટણિયે બેસો. તમારા પગને હિપ્સ કરતાં થોડાં પહોળા કરીને, એક બીજાથી અલગ કરો, તમારા પગના તળિયા આકાશ તરફ રહે તેવી રીતે પગ પાછળની તરફ વળેલા હોવા જોઈએ.

તમને વધુ સમય આ રીતે બેસવામાં કષ્ટ હોય તો પગની ઘૂંટી નીચે ટુવાલ કે કોઈ નરમ કપડું રાખવું જેથી તેના પર દબાણ ન આવે.

પીઠ અને ગરદન સીધા રાખીને બેસો. ખભા પણ ઢીલા મૂકી દો, અને હાથ ને જાંઘ ઉપર સરળતાથી રહેવા દો.

આ વિવિધ આસન ઉપરાંત, ભુજંગાસન અને અર્ધ મત્સ્યેન્દ્રાસન પણ ઉપયોગી સાબિત થાય છે.

ધ્યાન રાખો કે જો તમને કમરની, પીઠની કે ગરદનની સમસ્યાઓ હોય, કે ઘૂંટણને લગતી સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લઈને જ આસનો કરવા હિતકર છે. ■





મહિલા વન-ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર, પાંચ ઓક્ટોબરે ટકરાશે ભારત અને પાકિસ્તાન

દુબઇ: ક્રિકેટની વૈશ્વિક સંસ્થા આઇસીસીએ આ વર્ષે ભારત અને શ્રીલંકા દ્વારા યોજાનાર મહિલા વન-ે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ૫ ઓક્ટોબરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટકરાશે. કોલંબોને હાઇબ્રિડ મોડલ હેઠળ તટસ્થ સ્થળ તરીકે રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ૩૦ સપ્ટેમ્બરે બેંગલુરુમાં શ્રીલંકા સામેની મેચ સાથે તેના અભિયાનની શરૂઆત કરશે.

ભારત અને પાકિસ્તાનની ટીમો ૫ ઓક્ટોબરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે તટસ્થ સ્થળ પર મહિલા વન-ડે વર્લ્ડ કપ મેચમાં એકબીજાનો સામનો કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) એ આ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યારબાદની મેચો માટે સ્વીકૃત હાઇબ્રિડ મોડલ મુજબ કોલંબોને તટસ્થ સ્થળ તરીકે ઉમેરવામાં આવ્યું છે. ત્યારબાદ ભારતે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો હતો.

ટીમ ૨૬ ઓક્ટોબરે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બાંગ્લાદેશનો પણ સામનો કરશે, જેનાથી

માતા હજી આઈસીયુમાં: ગૌતમ ગંભીરનો ઇંગ્લેન્ડમાં ટીમ પાસે પાછા પહોંચવાનો નિર્ણય

નવી દિલ્હી: ભારતીય ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીરના માતાને હાર્ટ એટેક આવ્યા પછી હવે તેમની તબિયત સારી છે એટલે ગંભીરે ઈંગ્લેન્ડ પાછા જવાનો ગઈ કાલે નિર્ણય લીધો હોવાનું કેટલાક અહેવાલોમાં જાણવા મળ્યું હતું.

ઈંગ્લેન્ડ સામે ભારતની પાંચ ટેસ્ટની સિરીઝ શુક્રવાર, ૨૦મી જૂને શરૂ થશે અને એ પહેલાં જ ગંભીર ટીમ પાસે પહોંચીને બાકીનું કોચિંગ પૂર્ન કરવા માગે છે.

ગૌતમ ગંભીરનો ખેલાડી તરીકેની કરીઅર દરમ્યાન ભલાભલી હરીફ ટીમ સામે ન ઝૂકવાનો અભિગમ હતો અને વ્યક્તિગત સિદ્ધિ કે તકલીફને નજરઅંદાજ કરીને ટીમ માટેના લક્ષ્યને અગ્રક્રમ આપવાનું વલણ તેણે રાખ્યું હતું.

ગંભીરે પ્લેયર તરીકેના એ દ્રષ્ટાંતને હવે હેડ-કોચ તરીકેની જવાબદારી નિભાવવાનું પણ અપનાવ્યું છે.

ગૌતમ ગંભીરના મમ્મી સીમા ગંભીર દિલ્હીની

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિજય ઉજવણી દરમિયાન ભાગદોડ બાદ મેચોના ચજમાનીના અધિકારો ગુમાવવાની અફવાઓને રદિયો મળશે.

ભારતની અન્ય મેચ ૯ ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા અને ૧૨ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટનમમાં છે. ટીમ ૧૯ ઓક્ટોબરે ઇન્દોરમાં ઇંગ્લેન્ડ સામે અને પછી ૨૩ ઓક્ટોબરે ગુવાહાટીમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની ફિફ્ટિંગ ચેમ્પિયન છે જ્યારે ભારત પોતાનું પહેલું ટાઇટલ જીતવા માટે પ્રયાસ કરશે.

આ ટૂર્નામેન્ટ ૧૨ વર્ષ પછી ભારતમાં આયોજિત થશે. પહેલી સેમિફાઇનલ મેચ ૨૯ ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ મેચ ૩૦ ઓક્ટોબરે બેંગલુરુમાં રમાશે. ફાઇનલમાં પહોંચનારી બંને ટીમોને તૈયારી માટે બે દિવસનો સમય મળશે. મહિલા વનડે વર્લ્ડ કપની ફાઇનલ મેચ ૨ નવેમ્બરે બેંગલુરુ અથવા કોલંબોમાં રમાશે. મહિલા વન-ડે વર્લ્ડ કપમાં આઠ ટીમો ભાગ લેશે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (આયસીયુ)માં છે. જોકે ડોક્ટરના જણાવ્યા અનુસાર તેમની તબિયત હવે સુધારા પર છે.

ગૌતમ ગંભીર લંડન પહોંચીને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળશે અને ત્યાર પછી તેઓ બધા હોડિંગ્લી જવા રવાના થશે, જ્યાં લીડુસ ખાતે ૨૦મી જૂને પ્રથમ ટેસ્ટ શરૂ થશે.

૧૧મી જૂને ગંભીરના મમ્મીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને એની જાણ થતાં જ ગંભીર તરત ભારત પાછો આવ્યો હતો. તેની ગેરહાજરીમાં સહાયક કોચ રાયન ટેન ગ્રેબેટ, મોર્ની મોર્કલ અને સિતારું કોટ્ટે ટીમને કોચિંગ આપવાની જવાબદારી સંભાળી લીધી હતી. જોકે રવિવારે એક અહેવાલ એવો મળ્યો હતો કે બીસીસીઆઈએ એનસીએના ચીફ વીવીએસ લક્ષ્મણને ઇંગ્લેન્ડમાં ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાનું કહ્યું હતું.

બીજિંગ પેરા પાવરલિફ્ટિંગ વર્લ્ડ કપમાં ભાગ લેશે ૧૬ સભ્યોની ભારતીય ટીમ, ૧૭ જૂનથી થશે શરૂઆત

નવી દિલ્હી: ભારતની ૧૬ સભ્યોની ટીમ ૧૭ થી ૨૫ જૂન દરમિયાન બીજિંગમાં યોજાનાર ૨૦૨૫ પેરા પાવરલિફ્ટિંગ વર્લ્ડ કપમાં ભાગ લેશે. ટીમમાં ઝૈનબ ખાતૂન, સીમા રાની, ઝંડૂ કુમાર, જોબી મૈથ્યુ, મનીષ કુમાર અને કસ્પુરી જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ બધાએ તાજતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કર્યું હતું.

ખેલાડીઓ માટે રવિવારે એક ભવ્ય વિદાય સમારંભનું

ભાષા વૈભવ...

ગુજરાતી - અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A	B
સબબ	WONDER
તલબ	EXTENDED
પ્રલંબ	DELAY
ગજબ	REASON
વિલંબ	ADDICTION

ઓળખાણ પડી?

જા૭ સ્ટ્રીંગ ધરાવતા અને વેસ્ટર્ન કલાસિકલ મ્યુઝિકમાં વગાડવામાં આવતા તંતુવાદ્યની ઓળખાણ પડી? બેસીને કે ઊભા રહી વગાડી શકાય છે.

અ) Cello **બ) Harp** **ક) Viola** **ડ) Trumpet**

તાજિકિસ્તાન જશે ભારતની અંડર-૨૩ ટીમ, કોચ મૂસાએ કરી ખેલાડીઓના નામની જાહેરાત

નવી દિલ્હી : ભારતની અંડર-૨૩ પુરુષ ટીમના મુખ્ય કોચ નૌશાદ મૂસાએ સોમવારે તાજિકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિક સામે આગામી મૈત્રીપૂર્ણ મેચો માટે ૨૩ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેમાં સિનિયર ટીમના ત્રણ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. અેશિયન કપ ક્વોલિફાયરની તૈયારીને ધ્યાનમાં રાખીને ભારત માટે આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ ૧ જૂનથી કોલકાતામાં એઆઇએફએફ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પ્રેક્ટિસ કરી રહી હતી.

સપ્ટેમ્બરમાં એએફસી અંડર-૨૩ એશિયન કપ ૨૦૨૬ ક્વોલિફાયરની તૈયારીઓના ભાગ રૂપે ભારત ૧૮ જૂને તાજિકિસ્તાન અને ૨૧ જૂને કિર્ગિઝ રિપબ્લિક સામે ટકરાશે. બંને મેચ તાજિકિસ્તાનની રાજધાની દુશાબેથી લગભગ ૨૫ કિમી દૂર હિસોરના હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમમાં રમાશે. ટ્રેનિંગ સેશન ૨૯ ખેલાડીઓથી શરૂ થઈ હતી, જેમાંથી ૨૦

ફોરવર્ડ્સ: જોસેફ સની, મોહમ્મદ સનન કે, પાર્થિબ સુંદર ગોગોઈ, સુહેલ અહેમદ ભટ, ધિંગુજમ કોરુ સિંહ.

મુંબઈ સમાચાર

વરસાદે વરચે-વરચે બ્રેક લેતાં મુંબઈને બ્રેક ન લાગી

આમ છતાં ટ્રેનો મોડી દોડી, અનેક ઠેકાણે પાણી ભરાતાં ટ્રાફિક જેમ થયોઃ જોકે વરસાદ એકધારો ન વરસ્યો એટલે ૨૬ મેનું રી-રન ન થયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ સોમવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. રવિવાર રાતથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ આખો દિવસ પડ્યો હતો. જોકે વરસાદ સતત વરસવાને બદલે તબક્કાવાર એટલે કે થોડા થોડા સમયના અંતરે પડ્યો હોવાથી મુંબઈમાં ૨૬ મે, ૨૦૨૫નું પુનરાવર્તન ટળ્યું હતું. આ દરમ્યાન ગયે મહિને થયેલી અતિવૃષ્ટિમાંથી પાઠ ભણીને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વધારાના પંપ બેસાડીને પાણીનો નિકાલ સમયસર કર્યો હોવાથી ફરી એક વખત મુંબઈ જળબંબાકાર થતી બચી ગયું હોવાનો દાવો જોકે પાલિકા પ્રશાસને કર્યો હતો. હવામાન વિભાગે સોમવાર સવારથી ૨૪ કલાક માટે ઓરેન્જ અલર્ટ આપ્યું હતું.

મુંબઈમાં સોમવારે આખો દિવસ વરસાદ રહ્યો હતો. જોકે સતત વરસાદ પડવાને (જુઓ પાનું ૪) ►►



બેઠાલ: મુંબઈમાં સોમવારે ભારે વરસાદ પડ્યો હતો. કેમ્પ્સ કોર્નર પર બાઈક પર છત્રી સાથે જઈ રહેલું યુગલ. (અમય ખરાડે)

કોંકણમાં વરસાદની જોરદાર બેટિંગ

અનેક નદીઓ બે કાઠેઃ

મહારાષ્ટ્રભરમાં યોમાસાની જમાવટ

મુંબઈઃ મોન્સૂનનો વ્યાપ સંપૂર્ણ કોંકણમાં ફેલાયો છે ત્યારે વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ યોમાસાની એન્ટ્રી થઇ ગઇ હોવાનું જણાઇ રહ્યું છે. રવિવારથી પડી રહેલા વરસાદને કારણે કોંકણની નદીઓ બે કાઠે વહી રહી છે. રત્નાગિરી અને સિંધુદુર્ગમાં ૧૦૦ મિલિમીટર કરતા વધુ વરસાદ પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વિદર્ભના અમરાવતી, ગોંદિયા, ભંડારા અને નાગપુરમાં કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ તથા સાતારા અને પુણેના ઘાટ વિસ્તારમાં અતિવૃષ્ટિની આગાહી કરવામાં આવી હતી.

રત્નાગિરીમાં સોમવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. સિંધુદુર્ગમાં કણકવલી આચરા રાજ્ય માર્ગ પર પાણી ભરાઇ જવાને કારણે વાહનવ્યવહાર કપ થઇ ગયો હતો જેને કારણે ૧૫થી વીસ ગામનો સંપર્ક તૂટ્યો હતો. સમુદ્રમાં પણ હાઇટાઇડ દરમિયાન ત્રણથી ૩.૫ મીટર જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા (જુઓ પાનું ૪) ►►

કેમ બચી ગયા...

૨૬ તારીખે ભારે વરસાદને કારણે મુંબઈગરા બેહાલ થઈ ગયા હતા તેનું પુનરાવર્તન ગઈ કાલે ટળ્યું હતું. આ બાબતે પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સવારના ભરતી ન હોવાને કારણે વરસાદી પાણીનો ઝડપી નિકાલ થયો. રવિવારથી સતત વરસાદ પડવાને બદલે એટલે કે થોડા થોડા સમયે પડી રહ્યો હતો. ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડ્યો નહોતો. એ ઉપરાંત ૨૬ મેના ભારે વરસાદને કારણે હંમેશાના નીચાણવાળા વિસ્તારની સાથે જ જે પાણી ભરાવાનાં નવાં સ્થળો મળી આવ્યા છે તે જગ્યાએ પહેલાથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પંપ તૈયાર રાખવામાં આવ્યાં હતા.■

પ્લાસ્ટિકની શીટ મેટ્રો-૧ની સેવા ખોરવી, પ્રવાસીઓ પરેશાન

મુંબઈઃ ઘાટકોપરથી વસોવાને જોડતા મેટ્રો-૧ લાઇનમાં સોમવારે ટેક્નિકલ ખામીને કારણે સેવા ખોરવાઇ હતી. સવારે પીક અવર્સમાં આ સમસ્યા થવાને કારણે નોકરીયાતોને ઘણી તકલીફ પડી હતી અને તેઓ ફસાઇ ગયા હતા. ખાસ કરીને અંબેરી, મરોલ અને સાકીનાકાના કોર્પોરેટ હબમાં કામ કરનારાઓને ઘણી મુશ્કેલી પડી હતી.

સોશિયલ મીડિયા પર પ્રવાસીઓ દ્વારા કરાયેલી પોસ્ટ પ્રમાણે આઝાદ નગર મેટ્રો સ્ટેશન નજીક ખામી સર્જાઇ હતી. જોરદાર પવનો અને વરસાદ વચ્ચે એક કન્સ્ટ્રક્શન સાઇડ પરથી પ્લાસ્ટિકની શીટ ઉડીને મેટ્રોની લાઇનમાં આવી હતી અને ઓવરહેડ વાયરમાં ચોટી ગઇ (જુઓ પાનું ૪) ►►

૨૬ મેએ કેઇએમ હોસ્પિટલમાં પાણી નહોતાં ભરાયાંઃ હાઈ કોર્ટને જણાવાયું

મુંબઈઃ પાલિકા સંચાલિત કેઇએમ હોસ્પિટલમાં ગયા મહિને ૨૬મી મેના રોજ પેડેલા મુશળધાર વરસાદમાં પાણી ભરાઇ ગયા હોવાની વાત તદ્દન ગેરમાર્ગે દોરનારી છે. ફક્ત વરસાદનું પાણી ભેગું થઇ ગયું હતું જે તાત્કાલિક કાઢી નાખવામાં આવ્યું હતું, એમ હોસ્પિટલ તરફથી સોમવારે બોમ્બે હાઇ કોર્ટમાં જણાવાયું હતું.

ગયા મહિને પેડેલા વરસાદને કારણે

કેઇએમ હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયા હતા એના વાયરલ થયેલા વીડિયો અને સમાચારની હાઇ કોર્ટ ગંભીર નોંધ લીધી હતી તથા પાલિકાને હોસ્પિટલની ચકાસણી કરવા તથા તાત્કાલિક પગલાં લેવા કહ્યું હતું.

હાઇ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને હોસ્પિટલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હોસ્પિટલના કોઇ પણ ભાગમાં

પાણી ભરાયાં નહોતાં, પરંતુ જોરદાર પવનોને કારણે ફક્ત વરસાદનું પાણી ખુલ્લી જગ્યામાં ભેગું થઇ ગયું હતું જેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો.

દર્દીની જયાં સારવાર કરવામાં આવે છે ત્યાં કોઇ પાણી ભરાયાં નહોતાં તથા દર્દીઓને કોઇ રીતે રાહ જોવાડવામાં આવી નહોતી, એમ પણ સોગંદનામામાં જણાવાયું (જુઓ પાનું ૪) ►►

પશ્ચિમ રેલવેમાં સિનિયર સિટિઝનો માટે અલગ ડબ્બો

મુંબઈઃ બોમ્બે હાઇકોર્ટના નિર્દેશને પગલે, પશ્ચિમ રેલવેએ લોકલ ટ્રેનોમાં લગેજ કમ્પાર્ટમેન્ટને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કોચમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં, પશ્ચિમ રેલવેની ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ ઉપનગરીય ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે ૧૪ બેઠકો છે, ચર્ચગેટ બાજુથી ત્રીજા અને ૧૨મા કોચમાં દરેક બાજુ સાત બેઠકો છે, જે મુસાફરોની સંખ્યા માટે પૂરતી નથી.

મુંબઈમાં લોકલ ટ્રેનોમાં દરરોજ ૫૦,૦૦૦

થી વધુ વરિષ્ઠ નાગરિકો મુસાફરી કરે છે, ત્યારે એક જાહેર હિતની અરજીમાં તેમની દુર્દશા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને તેમના માટે ખાસ ડબ્બાની માગ કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, રેલવે બોર્ડ ચર્ચગેટ બાજુના સાતમા કોચ, જે હાલમાં લગેજ વાન છે, તેને એક્સકલુડિવ સિનિયર સિટિઝન કોચમાં રૂપાંતરિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

દરેક નવીનીકૃત ડબ્બામાં ૧૩ બેઠકો અને ૯૧ (જુઓ પાનું ૪) ►►

પુણેમાં ૧૨ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ

મુંબઈઃ પુણે કાઠમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે ૧૨ લાખ રૂપિયાની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ૩૪ વર્ષના યુવકની ધરપકડ કરી હતી. યુવકની ઓળખ શરણપ્પા નાગાપ્પા કટિમણી તરીકે થઇ હતી, જે મૂળ કર્ણાટકનો વતની છે. તેની વિરુદ્ધ એનડીપીએ એકટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. એએનસીના અધિકારીઓ શનિવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મળેલી માહિતીને આધારે તેમણે પુણેના બુધવાર પેઠ ખાતેના લક્ષ્મી રોડ પર છટકું ગોઠવીને શરણપ્પા કટિમણીને તાબામાં લીધો હતો.■

ચાર સ્કૂલને બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈ-મેઈલ મળતાં ખળભળાટ પોલીસે ‘સાયબર ટેરરિઝમ’નો કેસ નોંધ્યોઃ એક જ વ્યક્તિએ આ મેઈલ મોકલ્યાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ મુંબઈની બે અને મીરા-ભાયંદરની બે ઈન્ટરનેશનલ સ્કૂલને બૉમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. સઘન તપાસ બાદ પણ ચારેય શાળામાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જોકે આ પ્રકરણે પોલીસે ‘સાયબર ટેરરિઝમ’નો કેસ નોંધ્યો હતો, જેની તપાસ કાઠમ બ્રાન્ચે હાથ

ધરી હતી. મુંબઈમાં કાંદિવલી અને ગોવંડીના દેવનાર ખાતેની ઈન્ટરનેશનલ સ્કૂલને શનિવારે ઈ-મેઈલ મળ્યા હતા, જેમાં સ્કૂલ પરિસરમાં સોમવારે બૉમ્બ બ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલમાં હેઠરાખાદના બળાત્કાર કેસનો પણ કથિત રીતે ઉલ્લેખ કરાયો હતો અને દાવો કરાયો હતો કે બાળકો મરશે તો જ વાલીઓ તેની

નોંધ લેશે અને વિરોધ કરશે... આ વિરોધ થશે તો જ પોલીસ બળાત્કાર કેસની યોગ્ય તપાસ કરશે. પોલીસને શંકા છે કે શાળાઓમાં ધમકીભર્યા મેઈલ મોકલવા પાછળ એક જ વ્યક્તિ સંડોવાયેલી છે. જે ઈ-મેઈલ આઈડી પરથી આ મેસેજ આવ્યા છે તેની પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર ગોવંડીની

કાણકિયા ઈન્ટરનેશનલ સ્કૂલની એડમિનિશન ઑફિસરને સ્કૂલના ઑફિશિયલ ઈ-મેઈલ આઈડી પર શનિવારની સવારે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. આ મેસેજ દિવિજ પ્રબાકર લક્ષ્મીના ઈ-મેઈલ એકાઉન્ટ પરથી મોકલવામાં આવ્યો હતો. મેઈલમાં જણાવાયું હતું કે હેઠરાખાદમાં બળાત્કાર પીડિતાને ન્યાય આપવા માટે (જુઓ પાનું ૪) ►►

ઈન્સ્ટાગ્રામ વીડિયો કૉલ પર કપડાં ન ઉતારનાર યુવતીઓનો બ્લૅકમેલર પકડાયો

કમ્પ્યુટર નિષ્ણાત યુવક ઈનકાર કરનારી યુવતીઓને નામે બનાવટી પ્રોફાઈલ તૈયાર કરી અશ્લીલ મેસેજ-તસવીરો પોસ્ટ કરતો

આરોપીના મોબાઈલમાંથી યુવતીના ૧૩,૫૦૦ સ્કીનશૉટ્સ, ૧૦૦ ઈ-મેઈલ આઈડી અને ૧૧ બનાવટી ઈન્સ્ટાગ્રામ આઈડી મળ્યા!

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ સોશ્વલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર યુવતી-મહિલાઓને ફોલો કરીને તેમને વીડિયો કૉલ સામે નિર્વસ્ત્ર થવાની માગણી કરનારા યુવકને પોલીસે કર્ણાટકથી પકડી પાડ્યો હતો. કમ્પ્યુટર નિષ્ણાત યુવક માગણીનો ઇન્કાર કરનારી યુવતીના નામે બનાવટી પ્રોફાઈલ તૈયાર કરી સોશ્વલ મીડિયા પર અશ્લીલ તસવીરો-મેસેજ પોસ્ટ કરી રહ્યો હતો. તેના મોબાઈલ ફોનમાંથી ૧૩,૫૦૦ યુવતીના સ્કીનશૉટ્સ મળી આવ્યા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

દહિસર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ શુભમ કુમાર મનોજપ્રસાદ સિંહ (૨૫) તરીકે થઈ હતી. બિહારના બાગલપુર જિલ્લામાં રહેતા સિંહને કર્ણાટકના બેલ્વારી ખાતેથી તાબામાં લેવાયો હતો. આરોપીએ દિલ્હીના આઈટી સેન્ટર

ખાતેથી સૉફ્ટ સ્ક્રિલ કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામનો ડિપ્લોમા કર્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું.

દહિસરમાં રહેતી કૉલેજ સ્ટુડન્ટે ૩૧ જાન્યુઆરીએ નોંધાવેલી ફરિયાદને આધારે દહિસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે યુવતીના નામ અને તસવીરનો ઉપયોગ કરીને અજાણ્યા શખસે અમુક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બનાવ્યાં હતાં. બાદમાં આ એકાઉન્ટ્સથી યુવતી સંદર્ભે અતિશય બીભત્સ અને ઘુણાસ્પદ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યા હતા. યુવતીને બ્લૅકમેઈલ કરવાનો પ્રયાસ કરી આરોપીએ સોશ્વલ મીડિયા પર તેની બદનામી કરી હતી.

કેસની તપાસમાં દહિસર પોલીસે સાયબર પોલીસની મદદ લીધી હતી. જે ઈન્સ્ટાગ્રામ આઈડી (જુઓ પાનું ૪) ►►

દિવ્યાંગોના શેલ્ટર હોમમાં શરાબ અને શબાબની પાર્ટીઃ અદાલતનો તપાસનો આદેશ

મુંબઈઃ ૧૩ વર્ષ પહેલાં દિવ્યાંગ બાળકો માટેના મુંબઈ સ્થિત એક શેલ્ટર હોમમાં કથિત રીતે યોજાયેલા દારૂ અને ડાન્સરો સાથે નવા વર્ષની પૂર્વસંધ્યાએ યોજાયેલી પાર્ટી અંગે આચાર વ્યકત કરી બોમ્બે હાઇકોર્ટે સોમવારે અધિકારીઓ સામે તપાસના આદેશ આપ્યા હતા. મુખ્ય ન્યાયમૂર્તિ આલોક આરાધિ અને ન્યાયમૂર્તિ સંદીપ માર્નેની ખંડપીઠે નોંધ્યું હતું કે આ “આઘાતજનક” ઘટનાના ૧૩ વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.

ખંડપીઠે જણાવ્યું હતું કે તે સમયે તપાસ હાથ ધરવામાં આવી હતી એનું આશ્ચર્ય થયું હતું, પરંતુ અધિકારીઓ અથવા ગૃહના અધિક્ષક સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. હાઈ કોર્ટે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરને છ અઠવાડિયામાં તપાસ હાથ ધરવા અને “અપરાધી” અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી અને સજા માટે રાજ્ય સરકારને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. ત્રણ મહિનામાં અદાલતમાં કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.અદાલત સામાજિક કાર્યકર સંગીતા પુણેકર દ્વારા ૨૦૧૪માં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં (જુઓ પાનું ૪) ►►

મહારાષ્ટ્રમાં કોરોનાનો ૩૪ નવા કેસ, એક મૃત્યુ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડના ૩૪ નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે એક જણનું મૃત્યુ થયું છે. આ વર્ષે પહેલી જાન્યુઆરીથી રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૦૪૧ થઈ છે, જ્યારે મૃત્યુઆંક ૨૯ થયો છે. રાજ્યમાં હાલ કોરોનાના ૫૧૨ સક્રિય કેસ છે. મહાનગરમાં ૪૪ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું, એમ અધિકારીએ જણાવ્યું, તેણી કોનિક લિવર સિરોસિસથી પીડાતી હતી, જેને સહ-રોગ માનવામાં આવે છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે નવા કેસોમાં મુંબઈના ૧૨, પુણેના આઠ અને છત્રપતિ સંભાળનગરના સાત કેસનો સમાવેશ થાય છે. (પીટીઆઈ)■

ગિરગામમાં પાંચ ફૂટ ઊંડા ખાડામાં બેસ્ટની બસ ફસાઈ



સદ્નસીબે પ્રવાસીઓ હેમખેમઃ મેટ્રો નહીં બિલ્ડિંગ રીડેપલપમેન્ટને લીધે ખાડો પડ્યાની સ્પષ્ટતા

મુંબઈઃ દક્ષિણ મુંબઈના ગિરગામ ખાતે મેટ્રોના કન્સ્ટ્રક્શન સાઇટ નજીક પેડેલા ખાડામાં બેસ્ટની ઇલેક્ટ્રિક બસ સોમવારે સવારે ફસાઇ ગઇ હતી. તેમ છતાં આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી તથા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગિરગામ ખાતે અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે કાકુરદ્વાર સિગ્નલ નજીક ડો. બાબાસાહેબ જાયકર માર્ગ પર સવારે ૯.૩૦ કલાકે આ ઘટના બની હતી, એમ તેમણે કહ્યું હતું.

બેસ્ટના જણાવ્યાનુસાર બસ નંબર-૧૨૧ બેકબે રેપોથી જે. મહેતા માર્ગ તરફ જઇ રહી હતી ત્યારે તેનું પાછળનું ટાઇર ખાડામાં ફસાઇ હતું. આ ઘટનામાં કોઇને પણ ઇજા થઇ નહોતી. ત્યાર બાદ બસને ખાડામાંથી બહાર કાઢીને તે ફરી બેકબે રેપોમાં રવાના કરાઇ હતી. અમુક લોકોએ દાવો કર્યો હતો કે ત્યાં રસ્તા પર પાંચ ફૂટ ઊંડો ખાડો હતો. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિ. (એમએમઆરસીએલ) દ્વારા એક નિવેદનમાં ૯.૩૦ કલાકે આ ઘટના બની હતી, એમ જણાવાયું હતું કે ગિરગામ ખાતેની પ્રસ્તાવિક (જુઓ પાનું ૪) ►►

પુલને અગાઉ ખતરનાક જાહેર કરાયેલો, ચેતવણીનાં બોર્ડ પણ હતાંઃ ફડણવીસ



દ્રેબંડી: પુણેમાં તૂટી પડેલો પુલ. પુલ ક્યા કારણે તૂટી પડ્યો એ મામલે આક્ષેપો થઈ રહ્યા છે.

મુંબઈઃ પુણે જિલ્લાના માવળ તાલુકામાં ઈન્દ્રાવાણી નદી પરનો જર્જરિત કુંડમાલા પુલ તૂટી પડવાના એક દિવસ પછી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે જિલ્લા કલેક્ટર દ્વારા આ માળખું ‘ખતરનાક’ જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પ્રવાસીઓને કદાચ ગંભીરતાનો ખ્યાલ નહીં હોય.આ દરમિયાન, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર, જે પુણે જિલ્લાના પાલક પ્રધાન પણ છે, તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સોમવારે સ્થળ પર એનડીઆરએફની આગેવાની હેઠળની શોધ અને બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી. “આ હોનારત પહેલાં જિલ્લા કલેક્ટર દ્વારા આ માળખાને ખતરનાક જાહેર કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ ચેતવણીનાં બોર્ડ પણ લગાવ્યાં હતાં. પ્રવાસીઓને

કદાચ પુલની સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ ન હતો,’ એમ રાજ્યના ગૃહ ખાતાનો હવાલો સંભાળતા ફડણવીસે પાલઘર જિલ્લામાં સોમવારે પત્રકારોને જણાવ્યું. શિંદેએ કહ્યું કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, આવી દુર્ઘટનાઓ રોકવા માટે રાજ્યની નદીઓ પરના તમામ પુલનું માળખાકીય ઓડિટ કરવામાં આવશે. પુણે જિલ્લાના પાલક પ્રધાન પવારે જિલ્લા વહીવટીતંત્રને પુલ તૂટી પડવાની ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા સૂચના આપી છે. ‘પ્રાથમિક માહિતી દર્શાવે છે કે પુલની સ્થિતિ જર્જરિત હતી. તેથી, આ અકસ્માતની સંપૂર્ણ તપાસ કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે અને હું ખાતરી આપું છું કે જો જાળવણીમાં કોઈ બેદરકારી જણાશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. ■

બચાવકાર્ય એનડીઆરએફે બંધ કર્યું, પોલીસે ચાલુ રાખ્યું

પુણેઃ પુણે જિલ્લામાં આવેલી ઈન્દ્રાવાણી નદી પરનો લોખંડી બ્રિજ રવિવારે તૂટી પડવાની ઘટના બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)એ બચાવકાર્ય બંધ કરી દીધું હતું, જ્યારે સોમવારે પણ પોલીસે શોધ જારી રાખી હતી.

માવળ તહેસિલમાં બનેલી આ ઘટનામાં ચાર જણનાં મોત અને ૧૮ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જિલ્લા વહીવટીતંત્રના નિર્દેશ પ્રમાણે તમામ ગુમ

થયેલા લોકો મળી ગયા હોવાથી બચાવકાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું, એમ એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું હતું.

રવિવારે જોરદાર વરસાદ હતો અને રજા હોવાને કારણે નદી કિનારે લોકોની ભીડ જામી હતી. ત્યાં બ્રિજ જોખમી હોવાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું, પણ લોકોએ તેને નજરઅંદાજ કર્યો હતો. બ્રિજ તૂટી પડ્યો ત્યારે તેના પર ટૂ-વ્હીલર્સ અને ૧૫૦ જેટલા લોકો હાજર હતા. તેથી વધુ પડતા વજનને કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. ■

